



પ્રોફ્રેસર્સ લેક, અલડોરાડો પાર્ક આઉટડોર પૂલ, અને વેડિંગ પૂલ્સ જુલાઈ 14 નાં રોજ ફરીથી ખુલશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 10, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનના રિઓપનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, પ્રોફ્રેસર્સ લેક, અલડોરાડો પાર્ક આઉટડોર પૂલ, અને વેડિંગ (Wading) પૂલ્સ જુલાઈ 14 થી ફરીથી ખુલશે.

આ શહેર સામુદાયિક આરોગ્ય અને સુરક્ષાને ગંભીર રીતે લે છે, અને સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે.

પ્રોફ્રેસર્સ લેક

પ્રોફ્રેસર્સ લેક જુલાઈ 14 નાં રોજ ફરીથી ખુલશે જો હવામાન અનુકૂળ રહે, અને પાણીની ગુણવત્તા પરીક્ષણ પરિણામોને અધીન જે કામગીરી રીજીયન ઓફ પીલ કરશે. જુલાઈ 13 થી, મુલાકાતીઓએ 905.874.2350 નંબર પર કોલ કરીને ત્રણ કલાકનો ટાઈમસ્લોટ આરક્ષિત કરાવવો રહ્યો. બોટલાઉસ આગળ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રહેશે.

નીચેના સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે.

- વ્યક્તિગત/સમૂહ ઉપયોગ માટે બીચ વિસ્તારોમાં શારીરિક રીતે અંતર જાળવવા ચિલ્નો (માર્ક્સ) બેસાડવામાં આવશે. બધાં બીચ વિસ્તારો વચ્ચે બે મીટર (છ ફૂટ)નું અંતર રહે છે.
- સ્ટાફ એટેન્ડન્ટ્સ મુલાકાતીઓને તેઓના આરક્ષિત બીચ વિસ્તારોનું માર્ગદર્શન આપવા અને શારીરિક અંતરની દેખરેખ રાખવા સ્થળ પર હાજર રહેશે.
- રહેવાસીઓને પ્રતિબંધો અને માર્ગરેખાઓની જાણ કરવા અને ટ્રાફિકની યોગ્ય અવરજવરની ખાતરી કરાવવા COVID-19 ચિલ્નો મૂકવામાં આવશે.
- સમગ્ર સગવડમાં અને બીચ વિસ્તારની આસપાસ હેન્ડ સેનિટાઈઝર યુનિટ્સ મૂકવામાં આવશે. લોબી (પરસાળ), બીચ લોબી, વોશરૂમ્સ, અને પેટિઓ (ઉઘાડી જગ્યા)માંના બહુ અવારનવાર ઉપયોગાધિન સંપર્ક બિંદુઓનું સેનિટાઈઝેશન નિયમિત અંતરાળમાં થશે.
- સ્થળ પર ચેન્જ રૂમ સગવડો ઉપલબ્ધ નહિ થાય અને રહેવાસીઓને બીચ પર પોતાના દિવસ માટે જરૂરી પોશાક પહેરીને આવવાની સલાહ આપવામાં આવે છે.

અલડોરાડો પાર્ક આઉટડોર પૂલ

અલડોરાડો પાર્ક આઉટડોર પૂલ જુલાઈ 14 નાં રોજ ફરીથી ખુલશે જો હવામાન અનુકૂળ રહે, અને તે પૂલના ઉષ્ણતામાન પરિણામોને અધીન રહેશે.

નીચેના સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે.

- સમગ્ર સગવડમાં COVID-19 ચિલ્નો અને સેનિટાઈઝર યુનિટ્સ બેસાડવામાં આવશે અને સમગ્ર સગવડમાં બધાં સંપર્ક બિંદુઓ નિયમિતપણે સેનિટાઈઝ કરવામાં આવશે.
- ફ્લોટેશન (તરવામાં ઉપયોગી) સાધનો અને પૂલ ટોય્સ હંગામી ધોરણે કાઢી લેવામાં આવશે અને સહભાગીઓને પોતાના જરૂરી સાધનો, જેમ કે ફ્લેટર બોર્ડ્સ, ફ્લિપર્સ અને ગોગલ્સ લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. મુલાકાતીઓ વિનંતી કરવાથી લાઈફ જેકેટ્સ મેળવી શકશે.



- સ્થળ પર ચેન્જ ઝમ સગવડો ઉપલબ્ધ નહિ થાય અને મુલાકાતીઓને પૂલ પર પોતાના દિવસ માટે જરૂરી પોશાક પહેરીને આવવાની સલાહ આપવામાં આવે છે.
- દરેક અન્ય સિંક અને વોશરૂમ સ્ટોલ જે જાહેર જનતા માટે વોશરૂમ્સમાં ઉપલબ્ધ હોય છે તે બંધ રહેશે જેથી વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતરને પ્રોત્સાહિત કરી શકાય.

વેડિંગ પૂલ્સ

વેડિંગ પૂલ્સ જાહેર જનતા માટે જુલાઈ 14 થી ખુલશે, જો હવામાન અનુકૂળ રહે. આપણાં શહેરમાં ગેજ પાર્ક, ચિંગકુસી પાર્ક અને બાલ્મોરાલ રિક્રિએશન સેન્ટરમાં સ્થિત ત્રણ વેડિંગ પૂલ્સ કાર્યરત છે. રહેવાસીઓને પ્રતિબંધો અને માર્ગરેખાઓની જાણ કરવા COVID-19 ચિલ્નો મૂકવામાં આવશે. રહેવાસીઓને પૂરતી માર્ગરેખાઓ અને શારીરિક અંતર જાળવવાના ઉપાયો યાદ અપાવવા કર્મચારીગણ સ્થળ પર ઉપસ્થિત રહેશે.

રિમાઈન્ડર – સ્ટ્રે પેડ સંચાલનના ક્લાકો લંબાવવામાં આવ્યા

સ્ટ્રે પેડ સંચાલનના ક્લાકો લંબાવવામાં આવ્યા છે. હવામાન અનુકૂળ હોય ત્યારે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યાને બદલે, સ્ટ્રે પેડ્સ હવે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્ટ્રે પેડ સ્થળોની યાદી માટે વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ.

COVID-19 સુરક્ષા ઉપાયો

પીલ પબ્લિક હેલ્થ COVID-19 ને હરાવવા દરેક વ્યક્તિને [પાયાના ચાર](#) પગલાઓ અનુસરવાની ભલામણ કરે છે અને આ પગલાઓની યાદ અપાવે છે:

1. દૂર રહો: તમારા સુરક્ષિત સામાજિક વર્તુળ બહારની દરેક વ્યક્તિથી 2-મીટરનું અંતર જાળવો.
2. લેધર અપ (સાબુનો ઉપયોગ કરીને સાફ રહો): સાબુ અને પાણી વડે તમારા હાથ વારંવાર ધોતા રહો અથવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
3. માસ્ક અપ (મોઢું ઢાંકો): વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું મુશ્કેલભર્યું હોય અને માસ્ક્સ પહેરવા ફરજિયાત હોય ત્યાં નોન-મેડિકલ માસ્ક પહેરો. આરોગ્ય સંભાળ કાર્યકરો માટે મેડિકલ ગ્રેડ માસ્ક્સનો પુરવઠો સુરક્ષિત કરો.
4. પરીક્ષણ કરાવો: જો તમે વિચારતો હો કે તમને COVID-19 થયો હોઈ શકે અથવા તમે તેની સમક્ષ ઉઘાડા પડ્યા છો તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ. પરીક્ષણ પરિણામો માટે રાહ જોતી વખતે, ઘરે રહો, પોતાની જાતને અલગ રાખો અને સંભવિત ફેલાવો ટાળો.

કૃપા કરી પ્રોક્સર્સ લેક, અલડોરાડો પાર્ક આઉટડોર સ્વીમિંગ પૂલ કે વેડિંગ પૂલ્સમાં જશો નહિ જો તમને સારું ના લાગતું હોય.

જુલાઈ 10 થી અમલી, નવા હંગામી [બાય-લો](#) (પેટા-કાનૂન) હેઠળ, બ્રેમ્પટનમાં બંધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માસ્ક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા અનિવાર્ય બન્યા છે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca